

ઇન્ટરનેટ પર આંતરરાષ્ટ્રીય ક્રેડિટ કાર્ડનો ઉપયોગ

18 જૂન, 2002

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 30 ઓક્ટોબર, 2000 ના તેના પરિપત્ર એપી (ડીઆઇઆર સિરીઝ) નં. 19 ના ત્રીજા ફકરામાં દર્શાવ્યું છે કે, ક્રેડિટ કાર્ડ, એટીએમ કાર્ડ, ડેબિટ કાર્ડ, વગેરે ચૂકવણી માટેની અલગ પદ્ધતિ છે. ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ, 1999 (એફએમએ) હેઠળના નિયમો અને સૂચનો તેને પણ લાગુ પડે છે.

ઇન્ટરનેટ પર આંતરરાષ્ટ્રીય ક્રેડિટ કાર્ડના ઉપયોગ માટેની કેટલીક સ્પષ્ટતાઓ આ મુજબ છે :

- (i) ઇન્ટરનેશનલ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ ઇન્ટરનેટ પરથી ભારતમાં માન્યતા પ્રાપ્ત ડિલર્સ પાસેથી કોઈ પણ ખરીદી કરવા માટે વાપરી શકાશે. દા.તા. પુસ્તક મંગાવવા માટે, ડાઉનલોડ કરી શકાતા સોફ્ટવેરની ખરીદી માટે કે એકિઝમ પોલિસી અંતર્ગત માન્યતા પ્રાપ્ત કોઈ પણ વસ્તુ મંગાવવા માટે થઈ શકે છે.
- (ii) ઇન્ટરનેશનલ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ ઇન્ટરનેટ પર પ્રતિબંધિત વસ્તુઓ મંગાવવા કે ખરીદવા માટે થઈ શકશે નહીં. પ્રતિબંધિત વસ્તુઓ જેવી કે, લોટરીની ટિકિટ, પ્રતિબંધિ મેગેઝિન, કોલ સર્વિસ માટે ચૂકવણી, વગેરે ફોરેન એક્સચેન્જ માટે મંજૂરી અપાયેલી પ્રવૃત્તિ કે વસ્તુઓ મંગાવી શકાશે નહીં.
- (iii) ઇન્ટરનેશનલ ક્રેડિટ કાર્ડના ઇન્ટરનેટ પરના ઉપયોગ માટે કોઈ અલગ ભેગી કરેલી રકમની મર્યાદા નક્કી કરવામાં આવી નથી.

વધુમાં સ્પષ્ટ કરવામાં આવે છે કે, ડેબિટ કાર્ડ તથા એટીએમ કાર્ડ પણ ભારતમાં માન્યતા પ્રાપ્ત ડિલર પાસેથી ફોરેન એક્સચેન્જ ખરીદી માટે વાપરી શકાય છે.

માન્યતા પ્રાપ્ત ડિલર્સને પણ ડેબિટ કે ક્રેડિટ કાર્ડ મારફત પેમેન્ટ લઈ શકવાની મંજૂરી છે. આ બાબતની માર્ગદર્શિકા રિઝર્વ બેંક દ્વારા અલગથી મોકલવામાં આવી છે.

અજીત પ્રસાદ
પ્રબંધક

પ્રેસ રિલીઝ : 2001-2002/1392